

# આઈઆઈટીના વિદ્યાર્થીઓ સાથે સ્મૃતિ ઈરાનીએ 'ચાય પે ચર્યા' કરી

ભાસ્કર ન્યૂઝ. ગાંધીનગર

ગાંધીનગર પાસે આવેલા પાલજ ખાતે નવનિર્માત આઈઆઈટી ગાંધીનગરની કેન્દ્રીય માનવ સંશાધન મંત્રી સ્મૃતિ ઈરાનીએ સોમવારે મુલાકાત લીધી અને ગ્લોબલ ઈનીશીએટિવ ઓફ એકેડેમિક નેટવર્ક(ગ્યાન) પ્રોજેક્ટનું ઉદઘાટન કર્યું હતું. આ પ્રસંગે ગુજરાતનાં શિક્ષણ મંત્રી ભુપેન્દ્ર યુડાસમાં પણ હાજર રહ્યા હતા.

સ્મૃતિએ વિદ્યાર્થીઓને સંબોધતા કહ્યું કે વિદ્યાર્થીઓએ વિચાર્યું પણ નહિ હોય કે તેઓને વિદેશી નિષ્ણાતો ભણાવશે અને વૈશ્વિક સ્તરનું શિક્ષણ મળશે. ત્યારે ગ્લોબલ ઈનીશીએટિવ ઓફ એકેડેમિક નેટવર્ક માફરતે

## કેન્દ્રીય મંત્રી હજુ ઘણું આપવાનાં છે

શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ યુડાસમાએ કાર્યક્રમમાં બોલાવવા બદલ સંશાધન મંત્રીનો આભાર માની હળવાશનાં મૂડમાં કહ્યું કે આઈઆઈટીનું વિશાળ અને સુંદર કેમ્પસ જોતાં લાગે તે કેન્દ્રીય મંત્રી બહેન હજુ ઘણું આપવાનાં છે.

## શિક્ષણ ક્ષેત્રે ક્રાંતિ લાવવાનો શ્રેય મોદીને આપ્યો

શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ યુડાસમાએ શિક્ષણ ક્ષેત્રમાં ક્રાંતિ તથા ગુજરાતને આગળ લઈ જવાનો શ્રેય વડાપ્રધાન મોદીને આપતા જણાવ્યું કે ગુજરાતની જેમ દેશને પણ વડાપ્રધાન વિશ્વમાં આગળ લઈ જશે.

આઈઆઈટીનાં વિદ્યાર્થીઓ આ સ્તરનું શિક્ષણ મેળવી શકશે. તાલીમમાં વિદેશી ફેકલ્ટીની મદદની સાથે નેશનલ રીયર્સમાં પણ વિદેશો સાથે કોલાબ્રેશન કરવામાં આવ્યું છે. જેનો દેશ તથા શિક્ષણ જગતને પણ લાભ મળશે.